

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૮/૧/૨૦૧૫ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૫૭/૧૫

કાંઈમ બ્રાન્ચ :

રક્ષામાં વયો-વુધ્ધ સ્ત્રી-પુરૂષને મુસાફર તરીકે બેસાડી કિંમતી દર-દાગીનાની ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારની ધરપકડ કરતી અમદાવાદ કાંઈમ બ્રાન્ચ

કાંઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર ના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી એ.કે. શર્મા તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી હિમાંશુ શુક્લ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કાંઈમ બ્રાન્ચના અધિકારી શ્રીઓને સુચના કરેલ તે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એમ.ડી.ચૌધરી નાઓના માગ્ડેશન અને સુપરવિઝન હેઠળ એમ.ઓ.બી. સ્કોડ્ ના પો.સબ.ઇન્સ્પે. શ્રી એલ.ડી.વાઘેલા તથા માણસો ગઈ તા-૦૭/૦૧/૨૦૧૫ ના રોજ અમદાવાદ શહેર માં પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે રક્ષા માં વયો-વુધ્ધ સ્ત્રી-પુરૂષને મુસાફર તરીકે બેસાડી કિંમતી દર-દાગીનાની ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર શશીકન્ત @ પિન્ડુ સ/ઓ રાજારામ જાતે ભોલેરામ (સોનાર) (મરાઠી) ઉ.વ.૩૪ રહે- મકાન નં. ડી/૩૯૪ પાશ્વનાથ ટાઉન શીપ, મહાવીર સ્મૃતી વિ-૧૦, નવા નરોડ, અમદાવાદ નાને નવા નરોડા, પાશ્વનાથ કેનાલ રોડ પાસે પકડી પાડેલ જેની ઝડતી માંથી એક સોના નો દોરો કિં. રૂ.૩૨,૦૦૦/- મતાનો મળી આવેલ સદરી આરોપી તેના સાગરતો અમન ઉલ્લા ઉર્ફે મજીલાલ મન્સુરી રહે.દહેગામ તથા શાહરુખ મન્સુરી રહે.દહેગામ તથા રોહિત ચંન્દ્રકાંત જાધવ રહે.કૈન્કાડીવાસ સરદારનગર અમદાવાદ સાથે નરોડા બેઠક પાસે થી વયો-વુધ્ધ સ્ત્રી-પુરૂષને ટાગ્રેટ બનાવી મુસાફર તરીકે બેસાડી તેઓના કિંમતી સામાન ની ચોરી મુસાફરો ને નરોડા પાટીયા તથા સૈજપુર ટાવર આસપાસ અલગ અલગ બહાને ઉતારી દેતા જે બાબતે નરોડા પોલીસ સ્ટેશન ના બે ગુના દાખલ થયેલ છે. જે ગુનામાં સદરી આરોપીને નરોડા પોલીસ વધુ તપાસ સારૂ સોપેલ છે.

= આરોપી નો ગુનાહીત ઇતિહાસ =

અગાઉ સને ૨૦૧૦ માં શહેર કોટડા પોલીસ સ્ટેશન શરીર સબંધી કેસ માં ધરપકડ થયેલ છે. તથા સને ૨૦૧૧ માં રક્ષામાં બેઠેલ પેસેન્જરોના સામાન માંથી રોકડ તથા સોના- ચાંદી ના દાગીનાના ચોરીના ગુનામાં ગાંધીનગર સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં તથા બાપુનગર પોલીસ સ્ટેશન તથા સને ૨૦૧૨ ની સાલમાં આજ પ્રકારના ગુનામાં ઓઢવ પોલીસ સ્ટેશન પકડાયેલ અને એક વખત પાસા અટકાયતી થયેલ છે.



नायब पोलीस कमिशनर  
कंट्रोलरुम, अ'वाड शहेर  
पोलीस कमिशनर वती.